

ઓક્ટોબર 1, 2018

## સ્મોક ઍલાર્મ નહિ તો, આગ લાગવાની ઘટનામાં બચવાની કોઈ તક નહીં

બ્રામ્પટન, ઓન્ટેરિયો – માત્ર કાર્યરત સ્મોક ઍલાર્મ્સ આગ લાગવાની ઘટનામાં જીવન બચાવે છે.

દરેક ઘરમાં દરેક માળ પર અને દરેક સૂવાની જગ્યાઓ બહાર કાર્યરત સ્મોક ઍલાર્મ્સ અચૂક હોવા જોઈએ.

ઓક્ટોબર 6 અને 12 વચ્ચે, બ્રામ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ (BFES) સમગ્ર બ્રામ્પટનમાં વિવિધ સ્થળોએ આ સંદેશો ફેલાવશે કે માત્ર કાર્યરત સ્મોક ઍલાર્મ્સ જીવન બચાવે છે: સ્મોક ઍલાર્મ નહિ તો, આગ લાગવાની ઘટનામાં બચવાની કોઈ તક નહીં.

BFES કર્મચારીઓ ડોમિનો'સ, ઓલ્ડ નેવી, બ્રામલી સીટી સેન્ટર અને શોપર્સ વર્લ્ડ સહિતના ફાયર પ્રિવેન્શન વીકના ભાગીદારો સાથે જોડાઈને બ્રામ્પટનના રહેવાસીઓને આ મહત્વના સુરક્ષા સંદેશાઓ પહોંચાડશે.

ગુરુવાર, તા. ઓક્ટોબર 4 નાં રોજ, સીટી હોલમાં ફાયર પ્રિવેન્શન વીકની શરૂઆત અને ધ્વજ ફરકાવવાના સમારોહનું આયોજન થશે.

આ વર્ષની ઝાંખીમાં BFES' નું સ્ટેશન 209 ઓપન હાઉસ છે જે શનિવાર, તા. ઓક્ટોબર 6 નાં રોજ યોજાશે, જેમાં રહેવાસીઓ સ્ટેશન અને ટૂકનું ભ્રમણ કરી શકે છે; અને, હોમ એસ્કેપ પ્લાન લાવનારા પહેલા 50 કુટુંબો સ્મોક/કાર્બન મોનોક્સાઈડ ઍલાર્મનું મિશ્રણ મેળવશે.

ફાયર પ્રિવેન્શન વીક અને બ્રામ્પટનમાં થનારા પ્રસંગો વિશે વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [www.bramptonfire.com](http://www.bramptonfire.com)

### સ્મોક ઍલાર્મ અને આગ સંબંધિત હકીકતો (NFPW તરફથી):

- વર્ષ 2010-2014 વચ્ચે ઘરેલું આગની ઘટનાઓમાં દર પાંચમાંથી ત્રણ મૃત્યુ થવા પાછળનું કારણ ઘરોમાં સ્મોક ઍલાર્મ્સ નહિ હોવાનું અથવા કોઈ સ્મોક ઍલાર્મ્સ કાર્યરત નહિ હોવાનું હતું.
- 100 જેટલા ઘરોમાં નોંધાયેલી આગ દીઠ મૃત્યુનો દર કોઈ કાર્યરત સ્મોક ઍલાર્મ્સ ન હોય તેવા ઘરોમાં બમણીથી વધારે સંખ્યા જેટલો ઊંચો હતો.
- સ્મોક ઍલાર્મ્સ હોય પરંતુ કામ ન કરતા હોય તેવી આગની ઘટનાઓમાં, લગભગ અડધાં જેટલા ઍલાર્મ્સમાં બેટરીઓ કાં તો ગુમ હતી અથવા તો છૂટી (ઍલાર્મ્સ સાથે ન જોડાયેલી) હતી.
- મૃતપાય બેટરીઓથી એક-ત્રત્યાંશ જેટલા સ્મોક ઍલાર્મ્સ નિષ્ફળ જવાનું કારણ બન્યું હતું.

### અવતરણો (ક્વોટ્સ):

“ઘરેલું આગ રોકવા આપણો ભાગ ભજવવો એ આપણાં સૌની જવાબદારી છે, અને તેમાં આપણું પોતાનું અને આપણાં કુટુંબીજનોનું સંરક્ષણ કરવાનો સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે કાર્યરત સ્મોક ઍલાર્મ્સ જીવન બચાવે છે, અને આ વર્ષનું ફાયર પ્રિવેન્શન વીક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોથી ભરપૂર છે જે આપણને સૌને તેમાં ભાગ લેવા તૈયાર રહેવાનું મહત્વ યાદ અપાવે છે.”

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

“આંકડાઓ દર્શાવે છે કે ઉત્તર અમેરિકામાં ઘરેલું આગની ઘટનાઓમાં દર પાંચમાંથી આશરે ત્રણ મૃત્યુ કોઈ સ્મોક ઍલાર્મ્સ કાર્યરત નહિ હોવાને લીધે થયા હતા. એટલે જ આ વર્ષે, અમે આ સંદેશો ફેલાવીને આપણાં રહેવાસીઓને સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ: માત્ર કાર્યરત સ્મોક ઍલાર્મ્સ જીવન બચાવે છે. સ્મોક ઍલાર્મ નહિ તો, આગ લાગવાની ઘટનામાં બચવાની કોઈ તક નહીં.”

- બ્રામ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ચીફ બિલ બોયસ (Bill Boyes)

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સુપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મીડિયા સંપર્ક :**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા રિલેશન્સ

સીટી ઓફ બ્રામ્પટન

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)